

તમને વર્ષો સુધી આર્થિક રીતે સુરક્ષિત રાખી શકે તેવી પાંચ નાણાકીય ટેવ

વ ધારે પગાર હોવાથી જ કોઈ વ્યક્તિ આપોઆપ આર્થિક રીતે સુરક્ષિત બની જતી નથી. એવું શક્ય છે કે વ્યક્તિ સારો પગાર કમાતી હોય છતાં મહિનાના અંતે તેની પાસે ખૂબ ઓછા પૈસા બચે. બીજી તરફ, મર્યાદિત આવક ધરાવતી વ્યક્તિ પણ પોતાની દિનચર્યામાં કેટલીક સરળ ટેવો અપનાવીને મરજૂત નાણાકીય સુરક્ષા ઊભી કરી શકે છે.

૧. ખર્ચ પર નજર રાખો

પ્રથમ ટેવ એ બાબતની છે કે તમારા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. આ સાંભળવામાં ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ ઘણા લોકો પોતાના ખર્ચ કરતાં પોતાના રોકાણ પર વધુ ધ્યાન આપતા હોય છે. ભાડું, હોમ/કાર લોનના હપ્તા (EMI) અને શાળાની ફી જેવા નિશ્ચિત ખર્ચ પર નજર રાખવાની સાથે અજાણતાં થઈ જતા નાના-મોટા ખર્ચ પર પણ ધ્યાન આપો. ફૂડ ડિલિવરી, ઓનલાઈન સબ્સ્ક્રિપ્શન્સ, વારંવાર થતી ખરીદી અને બિનજરૂરી વસ્તુઓ પાછળ થતો ખર્ચ વર્ષના અંતે એક મોટી રકમ બની જાય છે. તમારે આજીવન દરેક ૧૦૦ રૂપિયાનો હિસાબ રાખવાની જરૂર નથી. માત્ર બે કે ત્રણ મહિના સુધી ખર્ચ ટ્રેક કરવાથી પણ ખર્ચ પડી જશે કે પૈસા ક્યાં વેડફાઈ રહ્યા છે અને લાઈફસ્ટાઈલને બહુ અસર કર્યા વગર ક્યા ખર્ચ ઘટાડી શકાય છે.

૨. ઇમરજન્સી ફંડ બનાવો

બીજી ટેવ એ છે કે વધુ સિટર્ન મેળવવાની લાલચ રાખતા પહેલાં એક ‘ઇમરજન્સી ફંડ’ (આપત્કાલીન ફંડ) ઊભું કરવું. ઇમરજન્સી ફંડ એ નોકરી જતી રહેવી, ઘરમાં મોટો સુધારો કરાવવો કે અચાનક તબીબી ખર્ચ આવી પડે તેવી સ્થિતિ માટે



અલગ રાખવામાં આવેલા પૈસા છે. આ રકમ કેટલી હોવી જોઈએ તે તમારી પરિસ્થિતિ પર આધાર રાખે છે; પરંતુ જે ઘરોમાં વધુ EMI ચાલતા હોય અથવા આવકનો માત્ર એક જ સ્ત્રોત હોય તેમણે મોટું ફંડ રાખવું જોઈએ. આ પૈસાને

૩. વીમો અને દેવું અલગ રીતે જુઓ

ત્રીજી ટેવ એ છે કે વીમા અને રોકાણને અલગ-અલગ ગણવા. હેલ્થ ઇન્સ્યોરન્સ હોસ્પિટલના મોટા બિલથી તમારી બચતને બચાવે છે, જ્યારે તમારા પર

આર્થિક સુરક્ષા માત્ર ઊંચા પગારથી નથી મળતી, પરંતુ સમય જતાં લેવાતા ના નાના નિર્ણયો અને સાચી ટેવોથી બને છે. ખર્ચ પર નજર રાખો, ઇમરજન્સી ફંડ બનાવો, નિયમિત રોકાણ કરો અને વર્ષમાં એક-બે વાર નાણાકીય સમીક્ષા કરો.

શરેખજાર જેવા બેંકમાં રોકાણમાં મૂકવાને બદલે સુરક્ષિત અને તરત વાપરી શકાય તેવી જગ્યાએ રાખવા જોઈએ. ઇમરજન્સી ફંડનો હેતુ પૈસા કમાવાનો નથી, પરંતુ મુશ્કેલીના સમયે તમારે મોંઘું દેવું ના કરવું પડે તે સુનિશ્ચિત કરવાનો છે.

પરિવાર નિર્ભર હોય ત્યારે પૂરતો લાઈફ ઇન્સ્યોરન્સ (જીવન વીમો) હોવો ખૂબ જરૂરી છે. માત્ર સિટર્ન મળશે તેવા આશયથી વીમો ખરીદવાથી ખર્ચેખર્ચ પૂરતું કવર મળવું છે કે નહીં તે સમજવું મુશ્કેલ બને છે. આ સિવાય, દેવાની સ્થિતિ પર પણ સતત ધ્યાન આપવું

જરૂરી છે. ક્રેડિટ કાર્ડનું બિલ એક મહિનાથી બીજા મહિને ખેંચવાથી વ્યાજ અને અન્ય ચાર્જ ઉમેરાતા તે ખૂબ મોંઘું પડી શકે છે. બિનજરૂરી શોપ કે ખર્ચ માટે લેવાતી પર્સનલ લોન માટે પણ આ જ વાત લાગુ પડે છે. નવી લોન લેતા પહેલા માત્ર માસિક હપ્તા (EMI) જોવાને બદલે, કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે તે જુઓ.



૪. નિયમિત રોકાણ કરો

ચોથી ટેવ એ છે કે ‘ચોગ્ય સમય’ની રાહ જોયા વગર નિયમિત રોકાણ કરવું. લાંબા ગાળાના લક્ષ્યો માટે નિયમિત રોકાણ શિસ્ત બાળવામાં મદદ કરે છે. ‘સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ (SIP) દ્વારા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં સમયાંતરે નિશ્ચિત રકમ રોકી શકે છે. જોકે, SIP એ રોકાણ કરવાની માત્ર એક પદ્ધતિ છે; તેમાં કેટલું બેંકમાં રહેવું

છે તેનો આધાર ફંડ અને તેના પોર્ટફોલિયો પર રહેલો છે.

૫. આવક વધવાની સાથે બચત વધારો

પાંચમી ટેવ એ છે કે આવક વધવાની સાથે બચત પણ વધારવી. જો તમારો માસિક પગાર ૧૦,૦૦૦ રૂપિયા વધે, તો તે આખી રકમ સારો ફોન લેવામાં, બહાર જમવામાં કે લાઈફસ્ટાઈલ સુધારવામાં વાપરી નાખવાનું મન થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ વધારાનો એક ભાગ પણ રોકાણ તરફ વાળવાથી લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ દર વખતે આવક વધવાની સાથે પોતાનું માસિક રોકાણ પણ વધારે છે, તે દાયકાઓ સુધી સરખી જ રકમ રોકનાર વ્યક્તિ કરતાં ઘણું મોટું ફંડ બનાવી શકે છે. જોકે, વાર્તાવિક પરિણામો સિટર્ન, રોકાણના સમયગાળા અને પસંદ કરેલા ઉત્પાદનો પર આધારિત હોય છે, તેથી સિટર્નની ગેરંટી ક્યારેય ન માનવી જોઈએ.

વાર્ષિક સમીક્ષા

સૌથી ઉપયોગી ટેવ એ છે કે વર્ષમાં એક કે બે વાર તમારા સમય નાણાકીય આયોજનની સમીક્ષા કરવી. તમારી બચત, રોકાણ, વીમો, લોન અને મુખ્ય વ્યવહાર વધારો કરવાની જરૂર પડી છે. જતાં જીવન બદલાય છે, અને પાંચ વર્ષ પહેલાં બનાવેલો પ્લાન તમારી વર્તમાન આવક કે જવાબદારીઓ સાથે મેળ ન પણ ખાતો હોય. નાણાકીય સુરક્ષા દરેક નિર્ણય સારો પડવાથી નથી મળતી; તે એટલી વાર સમજી-વિચારીને નિર્ણયો લેવાથી મળે છે કે જેથી એકાદ ખર્ચાળ મહિનો, અણધાર્યો ખર્ચ કે આવકમાં ફેરફાર તમારી આખી આર્થિક સ્થિતિને ખોટલી ન નાખે.

અમેરિકામાં વ્યાજદરમાં વધારો થયો, હવે ભારતનો વારો

લા જેતરમાં અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા 25 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે, જેની પાછળ ભારતીય રિઝર્વ બેન્ક પણ વ્યાજદરમાં વધારો કરશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે, તાત્કાલિક અસર રહેશે નહીં પણ ડિસેમ્બર સુધીમાં વધારો થઈ શકે છે. આમ, અમેરિકા બાદ ભારતનો વારો છે, એવું નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે.

લગભગ ત્રણ વર્ષના ગાળા પછી, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે, વ્યાજ દરને 3.75થી વધારીને 4 ટકા કરી દીધો છે. ફેડરલ રિઝર્વના આ વલણ બાદ દુનિયાભરના બજારોમાં ધમાલ તીવ્ર બની છે. સૌથી મજબૂત અસર ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં, ખાસ કરીને ભારતમાં જોવા મળશે. અમેરિકાના ફેડરલ રિઝર્વ બાદ જાપાનની સેન્ટ્રલ બેન્ક બેન્ક ઓફ જાપાને પણ 25 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે. જેના લીધે જાપાનનો વ્યાજદર પણ ઊંચાઈને પહોંચી ગયો છે. ઉંચા ફુગાવાના લીધે જાપાને પણ વ્યાજદર વધારો કર્યો છે. આમ,



યુરોપિયન યુનિયન, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશોએ વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે કુડ ઓઈલના ઉંચા ભાવથી ફુગાવો વધતો હોવાથી વ્યાજદર વધારો કરવાની ફરજ પડી છે. અમેરિકન વ્યાજ દરમાં વધારાને કારણે ડોલર ઈન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. આ દબાણ હેઠળ રૂપિયો નબળો પડ્યો છે અને પ્રતિ ડોલર 95ના સ્તરને પાર કરી ગયો છે. રૂપિયાની આ નબળાઈથી આયાતી ફુગાવો વધવાની ધમકી છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાથી વૈશ્વિક રોકાણકારો અમેરિકાની સલામત સંપત્તિ તરફ વળી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતીય શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું



વેચાણ વધુ તીવ્ર બનાવી શકાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં એફપીઆઈએ ભારતીય બજારમાંથી 2.41 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે. આ નિષ્ણયથી સોનાના ચમક પર ટૂંકા ગાળાનું દબાણ પણ આવવાની ધારણા છે.

બંકો માટે ભંડોળ એકત્ર કરવું મોંઘું થશે, જેના કારણે તેઓ હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દરમાં વધારો કરશે. જેમની લોન ફ્લોઈંગ રેટ પર છે, તેમના માટે માસિક ઇંમેઅર્થ રહેશે.

ઓક્ટોબરની બેઠકમાં વ્યાજદર વધારો કે નહીં તે અંગે અવધવ, પણ ડિસેમ્બરમાં નિશ્ચિત મનાય છે: નિષ્ણાતોનો મત

વપશે, જે સામાન્ય લોકોની નિકાલજોગ આવકમાં ઘટાડો કરશે. જ્યારે આ લોન વિરધ નાગરિકો અને બચત કરનારા રોકાણકારો બેંક એફડી પર વધુ સાફ વ્યાજ મેળવવાનું શરૂ કરશે. જ્યારે યુએસ ફેડરલ રિઝર્વ તેના નીતિગત દરોમાં ફેરફાર કરે છે, ત્યારે આરબીઆઈ વ્યાજ દરના તફાવતો, મૂડી પ્રવાહ અને ચલણ બજારોની અસર પર નજરથી નજર રાખે છે. જો કે, આરબીઆઈના નીતિગત નિર્ણયો પછાત વૈશ્વિક ફુગાવો, વૃદ્ધિ અને અન્ય આર્થિક પરિસ્થિતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઘરેલુ ફુગાવાના દબાણને કારણે આરબીઆઈએ મૂડી

જોકે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ મુખ્ય વેપાર માર્ગોને વિશ્લેષિત કરીને વૈશ્વિક અર્થતંત્ર માટે પડકાર ઉભો કરવાનું ચાલુ રાખે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, છૂટક ફુગાવો ઉંચો રહેશે, પણ ત્રીજા ક્વાર્ટર પર ટોચ પર પહોંચ્યા બાદ ઘટવાનું શરૂ થશે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં ફુગાવાના દબાણને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરમાં યોજાતી સમીક્ષા બેઠકમાં આરબીઆઈ તેમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. એચડીએક્સ બેંકનું માનવું છે કે ફુગાવાના દબાણ કેટલા વ્યાપક અને ટકાઉ છે તે અંગે સંપૂર્ણ સ્પષ્ટતા મેળવવા માટે આરબીઆઈ ડિસેમ્બર સુધી રાહ જોઈ શકે છે.

ભારતમાં ઘરેલું સંકેતો સારા, પણ હજુય વૈશ્વિક અડચણોથી શેરબજાર અથડાતું રહેશે



બ્રી કસ સમિટમાં જિનપીંગ-પુતિન સાથે રહીને ભારત મજબૂત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ ઊનાલ ટ્રમ્પ દ્વારા ટેરિફ વોરનો ભોગ ફરીથી ઝીંકી દીધો છે, જેનાથી ચીનના જિનપીંગ પણ ધ્રુજ ગયા છે અને તેઓ ટ્રમ્પની મુલાકાત કરી રહ્યા છે. જેમાં ટ્રમ્પ અને જિનપીંગ સાથે સમાપાનની ફીર્મ્યુલા બને છે તો ભારત માટે વધુ મુશ્કેલીઓ ઉભી થશે. હાલમાં ભારતની હાલત એવી છે કે, તેઓ રશિયા, ચીન કે અમેરિકા જેવા મોટા દેશોમાંથી પસંદગી કરવી, તે એક સમસ્યા થઈ છે. ટ્રમ્પની દિન પ્રતિદિન વધી રહેલી જોહુકમીની સામે હજુય કોઈ દેશ સક્ષમ દેખાતો નથી, અને રશિયા અને ચીન પણ પોતાના હિતમાં ટ્રમ્પ સાથે હાથ મિલાવી લેશે તો ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ જવાની હદેશત સેવાઈ રહી છે. હાલમાં ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ તે સરકારી ખર્ચના કારણે છે. નવી દિલ્હી ખાતે બ્રીક્સ સમિટ બેઠકમાં એવો માહોલ ઉભો કરવામાં

મિલાવીને ભારતને કટ ટુ સાર્ડઝ કરી શકે છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપીંગની આગામી સપ્તાહમાં અમેરિકાની મુલાકાત પર અત્યારે વિશ્વની નજર મંડાયેલી રહેશે. જેમાં ડ્રેગન ટ્રમ્પ સાથે હાથ મિલાવીને વિશ્વને ચોંકાવી દઈ શકે છે. જેમાં અમેરિકા સાથે મોડી ડીલ કરી શકે છે, જે ભારત સહિતના દેશો પરની ભીંસ વધારી શકે છે. આ સંજોગોમાં વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે. ભારત માટે અત્યારે દરેક મોરચે ઘેરાઈ રહ્યા છે. ભીજી તરફ, રશિયા પાસેથી કુડની ખરીદી પર અમેરિકાનું 100 ટકા સુધી ટેરિફ લાદવાનું જોખમ ઝળુંબી રહ્યું છે.

આ ટેરિફ વોરમાં ભારતની સમસ્યા વધુ સર્જશે. તાજેતરમાં બ્રેન્ટ કુડ 110 ડોલર નજીક પહોંચી ગયા બાદ અત્યારે ઘટીને 105 ડોલર રહ્યા છે, પરંતુ આ ભાવ વધવાનું જોખમ હજુય પુરેપુરું છે. ભારતનો રૂપિયો પણ અમેરિકી ડોલર સામે 95.88ના સ્તરે

છે. જ્યાં સુધી મીડલ ઈસ્ટનું યુદ્ધ શાંત નહીં થાય ત્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ ચાલુ રહેશે. મુડીલ દ્વારા વિકાસ દર એક ટકો વધારીને 7 ટકા થવાનો અંદાજ મુક્યો છે. જે અર્થતંત્ર માટે સારા સમાચાર છે, પણ ભારતીય શેરબજારમાં તેની કોઈ મોટી અસર જોવા મળી નથી. હજુય ભારતીય શેરબજાર કોઈ સારા અને મોટા સમાચારની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેથી આવનારા દિવસોમાં પણ ભારતીય શેરબજારમાં બેઉતરફી ઉથલપાથલ જોવા મળી શકે છે. જ્યારે બ્રોડર માર્કેટની વાત કરીએ તો પસંદગીના શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેથી સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં તેજીનો દોર જળવાઈ રહે તેવું લાગી રહ્યું છે અને ઘણી કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓની સાથે એક્ઝાઈવ્ઝાઈનું પણ આકર્ષણ જોવા મળ્યું છે.

જોકે, બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જે રીતે એક્ઝાઈવ્ઝાઈનની રહેવાઈ થઈ રહી છે અને તેમાં ફેરફાર વધતા વધુ વેચવાલી જોવા મળી શકે છે, ત્યારે હાલમાં જેમાં



એક્ઝાઈવ્ઝાઈનનું પ્રભુત્વ વધુ હોય તેવી કંપનીઓથી અળગા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સિવાય બજારની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી નથી, ત્યારે રોકાણકારોએ નાના નફા સાથે એક્ઝીટ થતા રહેવું જોઈએ. એકવાર બજાર સ્થિર થાય ત્યારબાદ લાંબાગાળાનું રોકાણ કરવું હિતાવહ રહેશે, પણ હાલની સ્થિતિ ભારતીય રિઝર્વ બેન્ક પણ વ્યાજદર વધારે તેવી સંભાવના દેખાઈ રહી

પહોંચી ગયો છે. અલ નીનોના કારણે ચોમાસુ જોઈએ એવું સફળ નહીં નીવડતા ચિંતા વધી છે. કેટલાક ભાગોમાં દુકાળની પરિસ્થિતિ છે, એટલું જ નહીં, ભારતમાં મોંઘવારી ભડકાવી રહી છે. ફેડરલ રિઝર્વ તથા બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધાર્યા છે અને હોલ ભારતીય રિઝર્વ બેન્ક પણ વ્યાજદર વધારે તેવી સંભાવના દેખાઈ રહી

કો પોર્ટ તરફી સુકાવ ધરાવતી કેન્દ્ર સરકારને મોડે મોડે ખ્યાલ આવ્યો છે કે, ભારતના ઉધોગો અને રોજગારની કસોટી માર્કેટ, સ્મોલ, મિડીયમ એન્ટરપ્રેન્સોર (MSME) જ છે. જે કૃષિ પછી સૌથી વધુ રોજગાર અર્જિત કરે છે. ભૂલ સુધાર કાર્યક્રમ હેઠળ હવે કેન્દ્ર સરકારે ૩ લાખ રૂપિયા સુધીના નાના મૂલ્યના નિકાસ કન્સાઈનમેન્ટ માટે રજીસ્ટ્રેશન-કમ-મેમ્બરશિપ સર્ટિફિકેટ (RCMC) અથવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાતમાંથી ‘ડી મિનિમિસ’ (લઘુત્તમ) મુક્તિ રજૂ કરી છે. આ પગલાનો ઉદ્દેશ્ય નવા અને નાના નિકાસકારો માટે પાલનનો બોજ ઘટાડવાનો અને ટપાલ, કુરિયર અને અન્ય ઉભરતા માધ્યમો દ્વારા નિકાસને



43 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ ભારતની કુલ મર્ચેન્ડાઈઝ નિકાસ મૂલ્યમાં માત્ર 0.86 ટકા હિસ્સો ધરાવે છે. તેથી આ મુક્તિથી એકંદર નિકાસ મૂલ્ય પર માત્ર આંશિક અસર પડીને મોટી સંખ્યામાં નાના મૂલ્યના નિકાસ વ્યવહારો આવરી લેવાય તેવી અપેક્ષા

RCMCમાંથી મુક્તિ MSMEs અને પ્રથમ વખત નિકાસ કરનારાઓ માટે પ્રવેશના અપરોધો ઘટશે. આ મુક્તિ ઇ-કોમર્સ અને અન્ય ઉભરતી નિકાસ ચેનલોને પણ સરળ બનાવશે. તે ટપાલ, કુરિયર અને અન્ય ઉભરતી ચેનલો દ્વારા ઓછા મૂલ્યની નિકાસને ટેકો આપશે

સરળ બનાવવાનો છે.

વિદેશ વ્યાપાર મહાનિદેશાલય (DGFT) એ વિદેશ વ્યાપાર નીતિ, 2023 ના પેરા 2.57 માં સુધારો કરીને જોગવાઈ કરી છે કે રૂ.3 લાખ સુધીના ફી-ઓન-બોર્ડ (FOB) મૂલ્ય ધરાવતા નિકાસ કન્સાઈનમેન્ટ માટે RCMC અથવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં, જ્યાં વિદેશ વ્યાપાર નીતિ હેઠળ અન્યથા આવું સર્ટિફિકેટ જરૂરી હોય. રૂ.3 લાખથી વધુના નિકાસ કન્સાઈનમેન્ટ માટે જ્યાં લાગુ પડતું હોય ત્યાં માત્ર RCMC અથવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ચાલુ રહેશે.

છેલ્લા પાંચ વર્ષ (2021-22 થી 2025-26) ના ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે ઓછા મૂલ્યની નિકાસ શિપિંગ બિલમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે પરંતુ એકંદર નિકાસ કન્સાઈનમેન્ટ માટે જ્યાં લાગુ પડતું હોય ત્યાં માત્ર RCMC અથવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ચાલુ રહેશે. આ પગલું પાત્ર નાના મૂલ્યના કન્સાઈનમેન્ટ માટે અગાઉથી RCMC મેળવવાની જરૂરિયાતને દૂર કરીને MSMEs, કારીગરો, નાના વ્યવસાયો અને પ્રથમ વખત નિકાસ કરનારાઓને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ માટે એક સરળ પ્રવેશ બિંદુ પ્રદાન કરે છે. આનાથી ઉભરતા નિકાસકારોને

વિદેશી બજારોનું પરીક્ષણ કરવા અને ઓછી પ્રારંભિક પાલન જરૂરિયાતો સાથે નિકાસનો ટ્રેક રેકૉર્ડ સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે. જેમ જેમ નિકાસકારો તેમની કામગીરીનો વિસ્તાર કરે છે અને તેમના કન્સાઈનમેન્ટ રૂ.3 લાખની મર્યાદાથી આગળ વધે છે, તેમ તેઓ સંબંધિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અથવા કમોડિટી બોર્ડની સભ્યપદ મેળવી શકે છે અને નિકાસ પ્રમોશન,



બજાર પહોંચ અને અન્ય સંસ્થાકીય સહાય સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. આ પગલું નવા નિકાસકારો માટે પ્રવેશના ઓછા અવરોધો પૂરા પાડે છે, જેથી પ્રથમ વખત અને ક્યારેક નિકાસ કરનારાઓને અગાઉથી RCMC મેળવ્યા વિના પાત્ર નાના મૂલ્યની નિકાસ કરવાની મંજૂરી મળે છે. તે ખાસ કરીને MSMEs અને નાના વ્યવસાયો માટે ફાયદાકારક છે, કારણ કે નાના ઉત્પાદકો, કારીગરો, સાહસિકો અને ઉભરતા નિકાસકારો વિદેશી બજારોની શોધખોળ કરી શકશે અને ઓછી પ્રારંભિક પાલન જરૂરિયાતો સાથે નિકાસ ટ્રેક રેકૉર્ડ બનાવી શકશે. આ મુક્તિ ઇ-કોમર્સ અને અન્ય ઉભરતી નિકાસ ચેનલોને પણ સરળ બનાવશે. તે ટપાલ, કુરિયર અને અન્ય ઉભરતી ચેનલો દ્વારા ઓછા મૂલ્યની નિકાસને ટેકો આપે તેવી અપેક્ષા છે જે વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી પહોંચવા માટે વધુને વધુ સક્ષમ બનાવી રહી છે. આ પગલું વૈશ્વિક બજારોમાં ઉભરતા નિકાસકારો કમીક સંકલનને ટેકો આપશે. જેમ જેમ નિકાસકારો સ્વેલ અપ કરશે અને ઉચ્ચ મૂલ્યના

ભારત-વ્યુઝીલેન્ડ FTA ભારતીય નિકાસના 100 ટકા માટે ડ્યુટી-મુક્ત એક્સેસ પ્રદાન કરશે

ભારત-વ્યુઝીલેન્ડ FTA ને અસરકારક બનાવવા માટે વ્યુઝીલેન્ડ કાયદાના પસાર થવાનું ભારતે સ્વાગત કર્યું છે. ભારત-વ્યુઝીલેન્ડ FTA ભારતીય નિકાસના 100 ટકા માટે ડ્યુટી-મુક્ત એક્સેસ પ્રદાન કરે છે 27 એપ્રિલ, 2026 ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરાયેલા ભારત-વ્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર (FTA) ને અમલમાં મૂકવા માટે 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ વ્યુઝીલેન્ડની સંસદ દ્વારા કાયદા પસાર થવાનું ભારત સ્વાગત કરે છે. આ કાયદાનો પસાર થવાથી કરાર અમલમાં લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને ભારત અને વ્યુઝીલેન્ડની તેમની આર્થિક ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવાની સહિયારી પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. જુલાઈ 2026 માં પ્રદાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વ્યુઝીલેન્ડની મુલાકાત, જે ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રદાનમંત્રીની વ્યુઝીલેન્ડની પ્રથમ મુલાકાત હતી, તેણે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપ્યો. મુલાકાત દરમિયાન, બંને પ્રદાનમંત્રીઓએ આર્થિક બેઝાણને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી અને ભારત-વ્યુઝીલેન્ડ FTA ના વહેલા અમલીકરણના મહત્વ પર ભાર મૂક્યો. ભારત અને વ્યુઝીલેન્ડ લાંબા સમયથી ગાઢ અને મજબૂત સંબંધો ધરાવે છે, જે લોકો વચ્ચે મજબૂત સંબંધો અને વેપાર અને રોકાણ, કૃષિ, શિક્ષણ, રમતગમત, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગના વિસ્તરણમાં વધારાવાળા છે. FTA આ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને બંને દેશોમાં વ્યવસાયો અને સમુદાયો માટે નવી તકો ઊભી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. આ કરાર અમલમાં આવ્યાની તારીખથી ભારતીય નિકાસના 100 ટકા માટે વ્યુઝીલેન્ડને ડ્યુટી-મુક્ત એક્સેસ પ્રદાન કરે છે, જે કાપડ અને વસ્ત્રો, ચામડું અને ફૂટવેર, એન્જિનિયરિંગ માલ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂલ અને પ્રોસેસડ ફૂડ ઉત્પાદનો સહિત ભારતીય નિકાસ માટે નવી તકો ખોલી છે. તે જ સમયે, તે લાકડું, ઊંળ, ઘેટાંનું માંસ અને ચામડાની કાચી ચામડા સહિત વ્યુઝીલેન્ડની નિકાસ માટે ભારતીય બજારમાં ઉજ્જત અને પસંદગીની એક્સેસ પ્રદાન કરે છે. આ કરાર સંસ્થાઓ, રોકાણ અને વ્યાવસાયિક, વિદ્યાર્થી અને યુવા ગતિશીલતામાં નવી તકોનું સર્જન પણ કરે છે, જેમાં ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે ઉજ્જત માર્ગોનો સમાવેશ થાય છે. તે ભારતમાં 20 અબજ ડોલરના રોકાણને સરળ બનાવવાની બેગવાઈ કરે છે અને કૃષિ ઉત્પાદકતા, ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો, પરંપરાગત દવા અને સાયુષ્ય, ટેકનોલોજી અને વેપાર સુવિધા સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવે છે. ભારત અને વ